



# બળજબરીપૂર્વકનાં અને વહેલાં લગ્ન

કોઇને લગ્ન માટે બળજબરી કરવીએ ઓસ્ટ્રેલિયામાં ગંભીર ગુનો છે.

ઓસ્ટ્રેલિયામાં લોકોને લગ્ન કરવાં કે નહિં તે નક્કી કરવાની આઝાદી છે. સામાન્ય રીતે, કાયદેસર લગ્ન કરવાં માટે જે તે વ્યક્તિ

૧૮ વર્ષથી વધુ ઉંમરની હોવી જોઇએ. અમુક સંજોગોમાં ૧૬ વર્ષથી ઉપરની વ્યક્તિ લગ્ન કરી શકે છે, પરંતુ તે માટે કોર્ટની મંજૂરીની જરૂર પડે છે.

વ્યક્તિ કોઇ પણ જાતની બળજબરી કે છેતરામણીનો ભોગ બન્યા વગર લગ્ન માટે સંમત થયેલ હોવી જોઇએ.

એરેન્જ મેરેજ (સગાં સંબંધી દ્વારાં ગોઠવાયેલાં લગ્ન), કે જેમાં બંને વ્યક્તિઓએ પોતાની મરજીથી લગ્નની સંમતિ આપી હોય તે બળજબરીથી થતાં લગ્નથી જુદાં છે. ઓસ્ટ્રેલિયામાં એરેન્જ મેરેજને કાનૂની માન્યતા છે.

જો તમે કે તમારી ઓળખીતી વ્યક્તિ જોખમમાં હોવ તો **000** પર પોલિસને ફોન કરો.

ઓસ્ટ્રેલિયામાં પોલિસ પાસે જવું સલામત છે અને તેમનાં પર વિશ્વાસ કરી શકાય છે.

મફત અને ખાનગી સલાહ (counselling) અને માહિતી માટે 1800 RESPECT ને **1800 737 732** પર ફોન કરો.

જો તમારે મફત દુભાષિયા સેવાની જરૂર હોય તો **131 450** પર ફોન કરો.

કોઇને બળજબરીથી લગ્ન કરાવવાં બીજા દેશમાં લઇ જવું કે મોકલી દેવું કે કોઇના દ્વારા તેની વ્યવસ્થા કરાવવી એ ગેરકાનૂની છે.

ઘણીવાર બળજબરીપૂર્વક અને વહેલાં લગ્ન કરાવવાંનાં હેતુથી વ્યક્તિને તેની ઇચ્છા વિરુદ્ધ બીજા દેશમાં કે સરહદની પાર મોકલી દેવામાં આવે છે, આમ કરવું ગેરકાનૂની છે.

શું તમે કે તમારું કોઇ ઓળખીતું જોખમમાં છો?

ઓસ્ટ્રેલિયાની સંયુક્ત (ફેડરલ) પોલિસ (Australian Federal Police (AFP)) ને **131 237** પર ફોન કરો. AFP શરૂઆતી સલાહસૂચન આપી શકે છે અને બળજબરીપૂર્વકનાં અને વહેલાં લગ્નનાં ભોગ બનનાર કે ઇચ્છા વિરુદ્ધ સરહદ પાર લઇ જવાતાં હોય તેવાં વ્યક્તિને મદદ, જેવી કે રહેવાની વ્યવસ્થા, જરૂરી પૈસાની વ્યવસ્થા, સલાહસૂચન અને કાયદાકીય સલાહ માટે નિર્દેશ કરી શકે છે.

વધુ માહિતી માટે AFP ની વેબસાઇટ [www.afp.gov.au](http://www.afp.gov.au) ની લિંક પર જશો.



## ઓસ્ટ્રેલિયામાં બીજી સેવાઓ પણ છે જે મદદ કરી શકે છે.

**1800 RESPECT** એ જાતીય સતામણી, ઘરેલુ અને પારિવારિક હિંસાનો ભોગ બનેલાઓને સલાહ આપતી ઓસ્ટ્રેલિયાની રાષ્ટ્રીય સ્તરની સેવા છે (Australia's National Sexual Assault, Family and Domestic Violence Counselling service). તે મફત અને ખાનગી સલાહ અને માહિતી, ફોન પર કે ઓનલાઇન આપી શકે છે. સલાહ આપનારાઓ તમારી વાતો સાંભળે, તમારા પ્રશ્નોના જવાબ આપી શકે અને તમારી નજીકના વિસ્તારમાં ઉપલબ્ધ બીજી મદદ કરતી સેવાઓ તરફ તમને દોરી શકે છે.

**1800 737 732** પર ફોન કરો અથવા 1800 RESPECT ની વેબસાઇટ [www.1800RESPECT.org.au](http://www.1800RESPECT.org.au) ની મુલાકાત લો.

## શું તમારે દુભાષિયાની જરૂર છે?

**131 450** પર ભાષાંતર અને દુભાષિયા સેવા (**Translating and Interpreting Service**) (ટીસ) માટે મફત ફોન કરો. ટીસ તમને બીજી સેવાઓ સાથે વાતચીત કરવામાં મદદ કરશે. ટીસ દ્વારા સલાહ (counselling) આપવામાં આવતી નથી.

બળજબરીપૂર્વકનાં લગ્ન અને ઇચ્છા વિરુદ્ધ સરહદ પાર લઇ જવાની બાબતમાં વધુ માહિતી માટે:

એટર્ની જનરલનાં ખાતાંની (Attorney-General's Department) વેબસાઇટ [www.ag.gov.au](http://www.ag.gov.au) ની લિંક પર જશો.